

સમરસ છાત્રાલયોમાં છાત્ર /છાત્રાઓએ પાળવાના નિયમો:-

૧	છાત્રાલયો માટે જે દિનચર્યા નક્કી કરવામાં આવે તે પ્રમાણે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ એ તેનું પાલન કરવાનું રહેશે.
૨	છાત્રાલયના સાધનો જેવા કે, ગરમ ધાબળા, સુતરાઉ ચોરસા, ચાદર, ગાદલું, તકીયા, શેતરંજી, ટેબલ ખુરશી, પલંગ, વગેરેને પુરતી કાળજીથી તેને કોઈ પણ જાતનું નુકશાન ન થાય તે રીતે વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ તેને સાચવવાના રહેશે અને તેને કોઈ પણ નુકશાન થશે કે ગુમ થશે તો તેની જવાબદારી વિદ્યાર્થીઓની પોતાની રહેશે.
૩	છાત્રાલયમાં આવતા મેગેઝીન અને છાપાઓની જાળવણી સારી રીતે કરવાની રહેશે.
૪	ભોજનાલયમાં જમતી વખતે જમવાની આઈટમ પીરસવા માટે મોટેથી અવાજ કરવો નહીં અને કર્મચારીઓની સાથે સારો વર્તવા કરવાનો રહેશે.
૫	ભોજન જે પીરસાય તેનો બગાડ કરવો નહીં તેમજ એઠવાડ કરવો નહીં જો એઠવાડ થાય તો તે નિયત કરેલ જગ્યાએ એઠવાડ રાખવાનો ડબ્બો કે સાધન રાખેલ હોય તે જગ્યાએ જ એઠવાડ નાંખવાનો રહેશે.
૬	છાત્રાલયના રસોડે સમયસર અને તે અંગે નક્કી કરવામાં આવેલ સમયે જ ભોજન લેવા ભોજનાલયમાં જવાનું રહેશે.
૭	ભોજન અંગે જો કોઈ પણ ફરિયાદ હોય તો તે વિવેકપુર્વક રીતે કાર્યાલયમાં જઈ રજુઆત કરવી તે અંગે હોદ્દા કે વાદવિવાદનું સ્વરૂપ આપવું નહીં.
૮	છાત્રાલયમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીએ નિયમિત અભ્યાસ કરવાનો રહેશે અને બીજા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થાય તેવું વર્તન કરવું નહીં.
૯	છાત્રાલયમાં વિદ્યાર્થીઓને /વિદ્યાર્થીનીઓ લેપટોપ કોમ્પ્યુટર તથા અન્ય ઉપકર્ણોની રજીસ્ટરમાં નોંધણી કરવવાની રહેશે અને તેનો જ ઉપયોગ કરી શકાશે.
૧૦	રાત્રિના સમયે કોઈપણ સગા વહલાને કે મિત્રો કે અન્ય વ્યક્તિઓને છાત્રાલયમાં રાખી શકાશે નહીં જો રાખશે તો ખુલાસાની તક આપી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
૧૧	વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના બીજા વિદ્યાર્થી સાથે પ્રેમભાવથી અને સંપથી રહેવાનું રહેશે તેમજ ઓફિસના તથા રસોડોના દરેક કર્મચારી સાથે વિવકપુર્ણ વર્તન કરવાનું રહેશે.
૧૨	વિદ્યાર્થી/વિદ્યાર્થીની કોઈ પણ જાતનું વ્યસન રાખી શકશે નહીં તેમજ પાન મસાલા ખાઈને થુંકી શકશે નહીં.
૧૩	દાકતરી અભિપ્રાય તથા એન.સી.સી.ના નિયમ મુજબ પાત્ર ઠરતા દરેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ એન.સી.સી.માં દાખલ થવું પડશે.
૧૪	દરેક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ પોતાની કોલેજમાં નિયમિત જવું પડશે તેમજ વગર રજાએ કોલેજ કે છાત્રાલયમાંથી ગેરહાજર રહી શકાશે નહીં. ગેરહાજર રહેશે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

૧૫	વિદ્યાર્થી/વિદ્યાર્થીની કોઈ વ્યાજબી કારણો સિવાય વારંવાર ગેરહાજર રહે અથવા એક માસથી વધુ સમય સતત ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવશે.
૧૬	ભ્રષ્ટ ચારિત્ર કે ગુનાહિત રેકર્ડ ધરાવતા તેમજ વ્યસની કે બીજી કોઈ ખામીવાળા વિદ્યાર્થી/વિદ્યાર્થીની તેમજ ચેપી રોગવાળા વિદ્યાર્થીઓ ધ્યાનમાં આવશે તો તપાસ કરી કાર્યવાહી કરી જરૂર પડ્યે છુટા કરવામાં આવશે.
૧૭	કોઈ પણ વિદ્યાર્થી/વિદ્યાર્થીની ને મળવા આવતા સગા વહાલાઓએ પ્રથમ છાત્રાલયની ઓફિસમાં આવીને કોને મળવાનું છે તેની જાણ કરવાની રહેશે અને તે પછી ઓફિસમાં રાખવામાં આવેલ રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે અને તે પછી વિદ્યાર્થીને મળવાની પરવાનગી મળ્યા બાદ વીઝીટીંગ રૂમમાં મળવા જવું કોઈ પણ સગાસબંધી કે વિદ્યાર્થી બારોબાર પોતાની રૂમ પર લઈ જઈ શકેશે નહીં.
૧૮	મુલાકાતીઓએ જે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મળવાનું હશે તેમને કોમન રૂમમાં જ્યાં મળવાની વ્યવસ્થા રાખવામાં આવેલ હશે ત્યાં મળવાનું રહેશે.
૧૯	મુલાકાતીઓએ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને રવિવાર અને ગુરુવારે મળી શકશે.
૨૦	વિદ્યાર્થી/વિદ્યાર્થીની ના માતા/પિતા /વાલી વધુમાં વધુ બે નામ રજીસ્ટર્ડ કરાવવાના રહેશે અને બન્ને વાલીઓના ઓળખકાર્ડ આપવામાં આવશે તે ઓળખકાર્ડ લઈને નકકી કરેલ સમયે પ્રવેશ આપવામાં આવશે અને તેની અવરજવર રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે.
૨૧	કન્યા છાત્રાલયના રૂમમાં પુરૂષ સદસ્ય તથા કુમાર છાત્રાલયના રૂમમાં મહિલા સદસ્યનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે તેમજ વાલી સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને છાત્રાલયના રૂમમાં પ્રવેશ આપી શકાશે નહિ.તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે જરૂર પડે છુટાકરી શકાશે.
૨૨	વિદ્યાર્થી/વિદ્યાર્થીનીએ પોતાના રૂમનો કચરો ડસ્ટબીનમાં નાખવાનો રહેશે.
૨૩	વિદ્યાર્થી/વિદ્યાર્થીનીએ આપેલ ટેબલ,કોટ ખુરશી વગેરે ઉપર ધુળ રહે નહીં તે રીતે દરરોજ સાફ સફાઈ કરવાની રહેશે.
૨૪	રૂમોમાં કપડા, ચંપલ કે બુટ વગેરે વ્યવસ્થિત રીતે ગોઠવવા અને જેમ તેમ રાખવા નહીં તેમજ ગમે ત્યાં થુકવું નહીં પોતાનો સામાન વ્યવસ્થિત રીતે ગોઠવવાનો રહેશે.
૨૫	છાત્રાલયમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને છાત્રાલયના જે રૂમમાં રહેવાનું નકકી કરવામાં આવે તે રૂમમાં જ વિદ્યાર્થીએ રહેવાનું રહેશે.
૨૬	છાત્રાલયમાં છાત્રાલયના સંચાલન વિરૂધ્ધ વ્યક્તિગત રીતે કે સમૂહમાં સત્રોચ્ચાર કરવા /કરાવવા નહીં અથવા તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે નહીં તેમજ કોઈપણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ શકાશે નહીં
૨૭	છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી પોતાની પાસે કોઈ પણ જાતના ઘાતક શસ્ત્રો રાખી શકશે નહીં.
૨૮	છાત્રાલયમાં રૂમની દિવાલો, બારીબારણા,સીડીમાં કોઈ પણ પ્રકારના નામ પોષ્ટરો, ચિત્રો દોરી શકાશે નહીં કે સુત્રો લખી શકાશે નહીં.

૨૯	છાત્રાલય નિવાસ દરમ્યાન કોઇપણ નિયમનો ભંગ અથવા ગેરશિસ્ત માટે અધિકારીશ્રીના પ્રાથમિક સુચના પછી પણ સુધારો નહીં જણાય તો છાત્રાલયના વડા ત્વરીત પગલા લઇ શકશે અને કરેલ કાર્યવાહીની જાણ સંબંધિત સમિતિમાં રજુ કરવાની રહેશે. અંતિમ નિર્ણય સંબંધિત કમીટી લેશે.
૩૦	આ ઉપરાંત હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા સરકાર તરફથી જે નીતિ નિયમો ઘડવામાં આવશે તેનું પાલન કરવાનું રહેશે.
૩૧	છાત્ર/છાત્રાલયમાં પ્રવેશ માટે રજુ કરેલ પુરાવાઓ ભવિષ્યમાં ખોટા માલુમ પડશે તો અધિકારીશ્રી ધ્વારા જે કોઇ કાર્યવાહી કરવામાં આવે તે વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને બંધનકર્તા રહેશે અને ખોટી માહિતી આપી પ્રવેશ મેળવેલ હશે તો પ્રવેશ રદ કરવામાં આવશે તે અંગે કોઇ વાંધો ગ્રાહ્ય રખાશે નહીં.
૩૨	છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યા બાદ હાજર થયે તુર્તજ અન્ય સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય તો તેની જાણ કરવાની રહેશે.
૩૩	છાત્ર /છાત્રાએ પ્રવેશ મેળવ્યા બાદ કોલેજ/સંસ્થા ધ્વારા લેવામાં આવતી તમામ પરીણામ ઓના આપવાના રહેશે તેના પરિણામની તુર્તજ જાણ કરવાની રહેશે જો ખોટી માહિતી આપવામાં આવશે તો પ્રવેશ આપોઆપ રદ ગણાશે.
૩૪	દરેક વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓએ છાત્રાલયનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે.
૩૫	છાત્રાલયમાં તમામ વિદ્યાર્થી વચ્ચે પરિચય કેળવાય તથા ભાઇચારો કેળવાય તે માટે સંતો / મહાનુભાવો ધ્વારા વખતોવખત કાર્યક્રમ સરકારશ્રી દ્વારા ગોઠવામાં આવે તેમાં તેમજ અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાનો રહેશે અને સમરસતાનું વાતાવરણ ઉભું કરવાનું રહેશે.
૩૬	વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય પર્વ ઉજવણીમાં અને અન્ય સરકારશ્રી ધ્વારા અપતા કાર્યક્રમોમાં ફરજિયાત હાજરી આપવાની રહેશે.
૩૭	છાત્રાલયમાં છાત્ર/છાત્રાઓની સલામતી માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવશે તેમ છતાં કોઇપણ અધર્મીત ઘટના કે અકસ્માત અંગે સરકારશ્રીને કે અધિકારીને જવાબદાર ઠેરવી શકશે નહિ.
૩૮	છાત્રાલયોમાં મહિલા સુરક્ષા અને સલામતી અંગે વિશેષ કાળજી રાખવામાં આવશે અને તે માટેના નિયત નીતી નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
૩૯	છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ છાત્રાલયના તમામ નિયમો/શિસ્તનું પાલન કરવાનું રહેશે. જો કોઇ વિદ્યાર્થી/ દ્વારા નિયમો ભંગ કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરી છુટા કરવામાં આવશે.
૪૦	સમયાંતરે રાજ્ય સરકાર, હોસ્ટેલના વડા દ્વારા જે નીતી નિયમો ઘડવામાં આવે તેનું પાલન વિદ્યાર્થી/વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે.